

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૬/૦૬/૨૦૧૮ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૦૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૧ કેસ કરી, ૬૬ વ્યક્તિઓને ઝડપી, ૫૬૦ લીટર દેશી દારૂ, ૨૭ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૨ સ્કુટર કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૮ કેસ કરી ૨૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૧૨,૩૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૦૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૧૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૩૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૨૦૪ /૧૮

મણીનગર : હાર્દિકભાઈ સતિષકુમાર ભટ્ટ (ઉ.વ.૨૮)(રહે,સમર્થ એપાર્ટમેન્ટ સુખીવાડીની સામે, કુષ્માબાગ મણીનગર) એ તા.૨૫/૬/૧૮ નારોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૫/૧૦/૨૦૧૭ થી તા.૨૫/૬/૧૮ બપોરના ૩/૦૦ દરમિયાન આરોપી ફેરીન હર્ષદભાઈ પટેલ (રહે, કીજ્ઞા ટાઉનશીપ ડબોલી રોડ કતાર ગામ રોડ સુરત તથા મુંબઈ મહારાષ્ટ્ર) એ હાર્દિકભાઈને મોટર સાયકલ ટ્રીઝમ કંપની ચાલુ કરવાની તેમજ ૨૦ બાઇકો ૩૫૦ CCના ગ્રાહકો દ્વારા નિર્ધારિત કરી, ગ્રાહકોને નિર્ધારિત કરેલી જગ્યા ઉપર ફેરવવાનું આયોજન કંપની કરતી હોઇ, ૧૦ બાઇકો રોયલ ઇનફીલ્ડ પુને તળે ગામથી ખરીદી કરવાની વાત કરી, હાર્દિકભાઈ પાસેથી રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- મેળવી લઇ, આજદીન સુધી હાર્દિકભાઈને પરત નહીં કરી, છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી ઉત્તમભાઈ બચુભાઈ ચલાવે છે.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૧૨૦૫ /૧૮

સેટેલાઇટ: શુશ્રીતભાઈ મોતીભાઈ પટેલ (રહે,આકાશગંગા માણેકબાગ સોસાયટી આંબાવાડી, નહેરુનગર, સેટેલાઇટ) એ તા.૨૫/૬/૧૮ નારોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૬/૨૦૧૮ સવારના ૯/૩૦ થી તા.૨૪/૬/૧૮ સાંજના ૫/૩૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનની બારી તોડી, અજાણી વ્યક્તિ ઘરમા પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૬,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭,૫૯,૫૦૦/- મતાની ચોરી કરી લઇ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી કે.ડી.ખાંભલા ચલાવે છે.

શાહીબાગ: પુષ્પાબહેન વા/ઓ રામાકિશોર સામરીયા(મહેશ્વરી) (ઉ.વ.૪૮)(રહે,અક્ષરપાર્ક સોસાયટી મહેશ્વરી સેવા સમિતિ પાસે, કબ્રસ્તાનની સામે શાહીબાગ) એ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૬/૨૦૧૮ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે સુજાતા ફ્લેટના ગેટ નજીક આવતા મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ પુષ્પાબહેનના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયો હતો. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી આર.પી.ડાભી ચલાવે છે.

શાહપુર: શારદાબહેન W/O ધનસિંગભાઈ દાંતણીયા (રહે,નિલકંઠ એપાર્ટમેન્ટ ઇદગાહ બ્રિજ નીચે શાહીબાગ) એ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૬/૨૦૧૮ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે શાહપુર ભાવસાર ચોક પાસે ગણપતિ મંદિર નજીક આરોપી કિષ્ના માસી (રહે, ઓતમપોળ સામે, હડકમઇ માતાના મંદિર પાછળ શાહપુર) એ શારદાબહેન સાથે ઝઘડો તકરાર કરી, મારા-મારી કરી, તેમના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ખેંચી તોડી ચોરી કરી નાસી ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.કે.અસોડા ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૨૦૭/૧૮

“જે” ટ્રાફિક પોલીસ સ્ટેશન : શીવકરણ રામસ્નેહી વાજપાઇ (રહે, પંડિત દિનદયાલનગર વિભાગ-૧, વિવેકાનંદનગર હાથીજણ) એ “જે” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૬/૧૮ ના ૧૦/૦૦ વાગ્યાના સુમારે રામોલ ચોકડી દાળવડાની લારી નજીક પોતાનો પુત્ર કૃષ્ણકુમાર શિવકરણ વાજપાઇ (ઉ.વ.૨૨) મોટર સાયકલ ચલાવી પસાર થઇ રહ્યો હતો દરમ્યાન એ.એમ.ટી.એસ બસ નંબર જીજે.૦૧.ડી.વાચ.૨૨૭૧ ના ચાલકે બસ પુરઝડપે અને બેદરકારીથી ચલાવી કૃષ્ણકુમારના મોટર સાયકલને ટકકર મારતા, કૃષ્ણકુમારને ગંભીર ઇજાઓ થતા, સારવાર અર્થે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન બપોરના ૧/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એ.બી.નાગોરી ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૨૦૮/૧૮

માધવપુરા: ગીતાબહેન વા/ઓ રાહુલભાઈ ઠાકોર (ઉ.વ.૨૦) (રહે. જુના માધવપુરા ઠાકોરવાસ) તા.૨૩/૬/૧૮ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ચાલુ પ્રાયમસમાં કેરોસીન ભરતા ભડકો થતા દાઝી ગયા હતા. સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૫/૬/૧૮ કલાક ૪/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે માધવપુરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી જે.ડી.બારોટ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.